



કોચ

દયા મેચ



મેચ 6



દયા વિ. સરખામણી

બાઈબલની વાર્તા: રાજા શાઉલ અને ડેવિડ

1 સેમ્યુઅલ 18:5-16

મેમરી વર્ડ:

ગલાતીઓને પત્ર 6:4 →

 રીંગ માં

"દરેકે પોતાની વર્તણૂકનો જાતે જ ન્યાય કરવો; કારણ, એમ કરવાથી તે પોતાની યોગ્યતાને આધારે ગર્વ કરી શકશે અને બીજાની સાથે સરખામણી કરવાની જરૂર રહેશે નહિ."

અઠવાડિયાની શરૂઆતમાં પોતાને 20 નાના દડા આપો. દર વખતે જ્યારે તમે તમારી જાતને અન્ય લોકો સાથે સરખામણી કરો છો, ત્યારે એક દડો દૂર કરો. આમાં ફેસબુક અથવા અન્ય ઓનલાઈન એપ્લિકેશનો શામેલ છે જ્યાં આપણે ઘણીવાર પોતાને અન્ય લોકો સાથે સરખાવીએ છીએ. જો તમારે જરૂર હોય, તો આખા અઠવાડિયા માટે ફેસબુકથી દૂર રહો.

સ્વાગત છે આપનું "ચેમ્પિયન્સ આત્માના ફળ દ્વારા" માં! તમારો ધ્યેય છે તમારા વિદ્યાર્થીઓને ચેમ્પિયન બનવામાં સહાય કરવાનો. આમ કરવા માટે, તેઓને દૈનિક જીવનમાં આત્માના ફળને કાર્યકારી રૂપમાં મૂકવાની જરૂર છે. મોટાભાગના રવિવાર સ્કૂલના કાર્યક્રમો ચર્ચમાં હોય છે, અને અઠવાડિયા દરમિયાન હોમવર્કની જરૂર હોતી નથી. જો કે, તમારા વિદ્યાર્થીઓ તેના વિશે શીખીને તેમના જીવનના પાપોને "હરાવી" શકતા નથી. તેઓએ ખરેખર "રિંગના અંદર" આવવું પડશે અને અઠવાડિયા દરમિયાન તેઓ જે વાસ્તવિક પાપનો સામનો કરશે તેની સામે લડવું પડશે. પ્રમાણિકપણે, અને વિષે તપાસ કર્યા વિના, આ કરવું લગભગ અશક્ય બનશે. કૃપા કરીને "તેમના શબ્દ પર વિશ્વાસ કરશો નહીં" અને સ્વીકારી ના લેશો જ્યારે વિદ્યાર્થીઓ કહે કે તેઓએ એસાઇનમેન્ટ કરી લીધું છે. જો તમે આ પ્રોગ્રામ વિશે ઢીલા પડશો, તો તમે તમારા વિદ્યાર્થીઓને તમને જૂઠું બોલવા માટે તાલીમ આપી શકશો. જો કે, મારી સાથે કલ્પના કરો કે જો તમે ખરેખર તમારા વિદ્યાર્થીઓને કોચિંગ આપી શકો છો, અને ટ્રેક કરી શકો કે તેઓ હોમવર્ક કરી રહ્યા છે, તો તમે તેમના જીવનમાં વાસ્તવિક પરિવર્તન જોશો. ફક્ત એક જ વર્ષમાં, તમે તેમની જીંદગીમાં પરિવર્તન લાવી શકો છો! તમારા વિદ્યાર્થીઓ આત્માના ફળને યાદ રાખશે નહીં, પરંતુ વાસ્તવમાં તેને જીવવાનું શીખશે! તમારી જવાબદારીઓ:

- 3-5 બાળકોને કોચિંગ આપે
- વિદ્યાર્થીઓ સાથે એસાઇનમેન્ટની ચર્ચા કરવા માટે અને ચેમ્પિયન્સ બનવા માટે પ્રોત્સાહિત કરવા માટે દર અઠવાડિયે ક્લાસ પહેલા અને પછી 5 મિનિટ માટે વિદ્યાર્થીઓને મળો.
- એસાઇનમેન્ટની યાદ અપાવવા માટે દર અઠવાડિયે વિદ્યાર્થીઓને કૉલ/ટેક્સ્ટ દ્વારા સૂચિત કરો. (સૂચિત = મંગળવાર)
- પૂર્ણ થયેલ એસાઇનમેન્ટનો રિપોર્ટ મેળવવા માટે અઠવાડિયે બીજી વાર વિદ્યાર્થીઓને કૉલ/ટેક્સ્ટ દ્વારા સૂચિત કરો. (સૂચિત = શુક્રવાર)
- નાના જૂથના બાળકો માટે કરવામાં આવેલ એસાઇનમેન્ટનો ટ્રેક રાખો અને હેડ કોચની દર અઠવાડિયે જાણ કરો.

પુરસ્કારો:

કોચ બનવાનો મહત્વપૂર્ણ ભાગ એ છે કે તમારા વિદ્યાર્થીઓને વિજેતાઓ જેવો હેષા આપવો. આનો અર્થ એ છે કે તમે જે વર્તનની અપેક્ષા રાખી રહ્યા છો તેને તમારે વ્યાખ્યાયિત કરવાની અને તે વર્તનને પુરસ્કાર આપવાની જરૂર છે.

નાના-નાના સાપ્તાહિક પુરસ્કારો:

- હગ (આલિંગન)
- હાઈ-ફાઈવ્સ
- તેમના શર્ટ પર સ્ટીકર
- હાથ પર સ્ટેમ્પ
- નાની કેન્ડી

મહિનાના અંતે મોટા પુરસ્કારો:

- બાળકોને સુવર્ણ, રજત અને કાંસ્ય ચંદ્રકો આપવાના પુરસ્કાર સમારોહ. (3 અઠવાડિયાના એસાઇનમેન્ટ માટે કાંસ્ય, 4 અઠવાડિયા માટે રજત, અને 5 અઠવાડિયા માટે સુવર્ણ ચંદ્રક. વૈકલ્પિક રીતે, તમે 2 પંચ માટે કાંસ્ય, 3 પંચ માટે રજત અને અઠવાડિયામાં 4 પંચ માટે સુવર્ણ પણ આપી શકો છો.)
- તમારા ઘરે એક પાર્ટી
- પ્રમાણપત્રો
- ચર્ચમાં પુખ્ત લોકોની સામે ચર્ચમાં કંઈક મોટું આપવું
- ટ્રોફી

તમારા વિદ્યાર્થીઓને આત્માના ફળમાં કોચિંગ કરવાના પડકારમાં આપણા ઈશ્વર તમને પ્રેરણા આપે એવી શુભેચ્છા!



મેચ 7

દયા વિ. કપટ

બાઈબલ વાર્તા: પીટર ખ્રિસ્તને નકારે છે
મેથ્યુ 26:31-35, 69-75
મેમરી વર્ઝ: ગીતશાસ્ત્ર 26:4



"હું જૂઠા માણસોની સાથે બેઠો નથી. અને
દંભીઓની સોબતમાં ભબ્યો નથી."



રીંગ માં

આ અઠવાડિયે, જેમને તમે ખોટું કહેલું હોય તેવા કોઈની પાસે જાઓ, અને તેમને સત્ય જણાવો. જૂઠ બોલવા બદલ માફી માંગો, અને તેમને માફ કરવા માટે કહો. દર વખતે જ્યારે તમે પાછા આવો છો અને સત્ય કહો છો ત્યારે આ પાપ સામે બીજી મોટી જીત હશે.



મેચ 8

દયા વિ. અલિપ્તતા

બાઈબલની વાર્તા: રૂથ અને નાઓમી
રુથ 1:8-22
મેમરી વર્ઝ:
સુભાષિતસંગ્રહ 3:27



"કોઈને તારી મદદની જરૂર હોય અને તું એને મદદ
કરી શકે તેમ હોય, તો તેને ના પાડીશ નહિ."



રીંગ માં

મદદ કરવા માટે કોઈને શોધો, ખાસ કરીને જો તેઓ "તમારી સમસ્યા નથી." શેરીમાં રહેલા બેઘર વ્યક્તિને, અથવા કદાચ શાળામાં નવી પેંસિલ અથવા ઈરેઝરની જરૂરવાળા બાળકને આપો. ખાતરી કરો કે તેઓ તમારી સાથે સંબંધિત નથી, અને તમારી તેમને મદદ કરવાની જરૂર અથવા જવાબદારી નથી.



મેચ 9

દયા વિ. દ્વેષ

બાઈબલની વાર્તા: એસ્થર તેણીના
લોકોને બચાવે છે એસ્થર 3-5
મેમરી વર્ઝ: રોમનોને પત્ર 15:14



"મારા ભાઈઓ, તમારે વિષે મને પૂરી ખાતરી છે કે તમે
ભલાઈથી ભરેલા છો. તમે સર્વ જ્ઞાનથી સંપન્ન છો. તમે
એકબીજાને શીખવી શકો તેવા છો."



રીંગ માં

આ અઠવાડિયે તેમના પ્રત્યે સ્વાર્થી બની રહેલા કોઈકને કોઈ કારણ વગર સુરક્ષિત કરો. જ્યારે આપણે કોઈ બીજાનું રક્ષણ કરીએ છીએ, તેમ આપણે આપણા પોતાના હૃદયમાં આ પાપ સામે લડીશું. કોઈ બીજાને બચાવવા માટે તમારી પોતાની પ્રતિષ્ઠાને જોખમમાં મૂકો.



વિદ્યાર્થીઓ



1

મેયો

1 2 3 4 5

પ્રદાર
ક્રોસ
હૂક
અપરકટ

2

મેયો

1 2 3 4 5

પ્રદાર
ક્રોસ
હૂક
અપરકટ

3

મેયો

1 2 3 4 5

પ્રદાર
ક્રોસ
હૂક
અપરકટ

4

મેયો

1 2 3 4 5

પ્રદાર
ક્રોસ
હૂક
અપરકટ

5

મેયો

1 2 3 4 5

પ્રદાર
ક્રોસ
હૂક
અપરકટ

6

મેયો

1 2 3 4 5

પ્રદાર
ક્રોસ
હૂક
અપરકટ

